

RAN-2408000604050005

S.Y.B.Com. (Sem.-IV) Examination April - 2026

BANKING - II (SEC)

Time: 2 Hours]

[Total Marks: 25

સૂચના : / Instructions	Seat No.:
(1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book	
	Student's Signature

- પ્ર.1. ટૂંકમાં જવાબ આપો : (કોઈ પણ પાંચ) 10**
- બેંક વિલીનીકરણ એટલે શું?
 - ભારતમાં બેંક રાષ્ટ્રીયકરણના કોઈપણ ચાર મુખ્ય ફાયદાઓ નો ઉલ્લેખ કરો.
 - લોન અને એડવાન્સ વચ્ચેના તફાવતના કોઈપણ ચાર મુદ્દા જણાવો.
 - સ્ટાર્ટ અપ લોન માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો જણાવો.
 - વાર્ષિક ટકાવારી દર (એ.પી.આર) એટલે શું?
 - બેન્કો માટે CIBIL સ્કોર ના કોઈ પણ ચાર મહત્વ જણાવો.
 - ભારતમાં બેંક વિલીનીકરણ ને કોણ મંજૂરી આપે છે? કઈ નિયમનકારી સંસ્થાઓ સામેલ છે?
- પ્ર.2. અ. વાર્ષિક ટકાવારી દર (APR) ના પ્રકાર મુદ્દાસર જણાવો. 07**
- બ. ભારતમાં બેંક વિલીનીકરણ ના મુખ્ય ઉદ્દેશો વિગતવાર ચર્ચો. 08
- અથવા**
- પ્ર.2. અ. જાહેર ક્ષેત્રની બેંકોના વિલીનીકરણના ફાયદાઓ વિગતવાર ચર્ચો 07**
- બ. તમારો અભિપ્રાય આપો. 08
- તમારી બેંકનો એક ગ્રાહક જે સરકારી કર્મચારી છે. જે હાઉસિંગ લોન લેવા માટે બેંકમાં અરજી કરે છે. બેંકમાં લોનની કાર્યવાહી કરવા જરૂરી દસ્તાવેજો પણ આપે છે. બેન્કર તરીકે તમે સિબિલ સ્કોરની ચકાસણી કઈ રીતે કરશો?
 - અંકીત પટેલ યુનિયન બેંક, બારડોલીમાં ચાલુ ખાતું ધરાવે છે. તે આ ખાતામાંથી ટૂંકા ગાળાની એક વર્ષની લોન લેવા માંગે છે. ટૂંકા ગાળા માટે તમે કયા પ્રકારનું ધિરાણ મંજૂર કરશો? એક બેંકર તરીકે તમે શું કરશો.

ENGLISH VERSION

- Q.1. Answer Briefly : (Any five) 10**
- What is bank merger?
 - Mention any four major advantages of bank nationalization in India.
 - State any four points of difference between loan and advance.
 - State the documents required to apply for a start-up loan.

5. What is Annual Percentage Rate (APR)?
6. State any four importance of CIBIL score for banks.
7. who approves bank mergers in India? What regulatory bodies are involved?

- Q.2.** A. Explain the types of Annual Percentage Rate (APR) in detail. **07**
B. Discuss in detail the main objectives of bank mergers in India. **08**

OR

- Q.2.** A. Discuss in detail the benefits of merger of public sector banks. **07**
B. Give your opinion as a banker. **08**
1. A customer of your bank who is a government employee. Who applies to the bank for a housing loan. He also provides the necessary documents to process the loan in the bank. How will you check the CIBIL score as a banker?
 2. Ankit Patel has a current account in Union Bank, Bardoli. He wants to take a short-term loan of one year from this account. What type of loan will you approve for a short term? What will you do as a banker?
-